

Date: May 26, 2021

<p>To, The Manager, Listing Department, National Stock Exchange of India Limited (NSE), Exchange Plaza, C – 1, Block – G, Bandra – Kurla Complex, Bandra (E), Mumbai-400 051.</p>	<p>To, The Department of Corporate Service, BSE Limited, 1stFloor, New Trading Ring, Rotunda Building, Phiroze Jeejeebhoy Tower, Dalal Street, Mumbai – 400 001.</p>
<p>Symbol – LINCOLN</p>	<p>Scrip Code – 531633</p>

Dear Sir,

Sub.: Newspaper Advertisement – Audited Financial Results (Standalone and Consolidated) for the Quarter and Year Ended March 31, 2021.

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclosed herewith the copies of published newspaper advertisement with respect to the audited financial results (standalone and consolidated) of the Company for the quarter and year ended March 31, 2021. The said advertisement was published in the following newspapers:


1. The Economic Times, Ahmedabad Edition - In English;
2. Jay Hind, Ahmedabad Edition - In Gujarati.

Kindly take the same on your records.

Thanking you,

Yours faithfully,

For Lincoln Pharmaceuticals Limited



Niren A. Desai
Company Secretary



Encl: A/a

Economy: Macro, Micro & More

Rapid Rail AC Order to China Firm Under DPIIT Scanner

Contract to be reviewed for any possible violation of the Make in India norms

Kirtika Suneja & Nishtha Saluja

New Delhi: The Department for Promotion of Industry and Internal Trade (DPIIT) is likely to review the award of air conditioning contract for metro cars for the Delhi-Meerut Rapid Regional Transport System (RTS) to a Chinese company for any possible violation of the Make in India guidelines.

The project is being developed by the National Capital Region Corporation (NCRTC). Bombardier is supplying the metro cars while the air conditioning contract has gone to a Chinese company KING.

Home-grown air conditioning companies Sidwal Refrigeration Industries Private Limited raised the matter with the department alleging that a Chinese vendor was roped in despite indigenous Heating, Ventilation and Air-Conditioner (HVAC) products being available.

"In the case of RTS project, when the fully indigenous developed HVAC are available, the contractor/Bombardier has decided to go with Chinese vendor KING despite lot of local industries are available in India," Sidwal Refrigeration Industries Private Limited said in a letter to the DPIIT earlier this year.

While NCRTC has maintained that the contract was awarded to the Chinese company before approval order in July last year mandating procurement of items locally where enough domestic capacity was available, officials said that the DPIIT will still look into the case since a Chinese entity is involved.

"We will look into the issue," said an official, adding that a meeting on the matter is likely soon. An email sent to the commerce and industry didn't elicit a response. HVAC is mentioned in the list of 'Mandatory Items' issued by the Ministry of Housing and Urban Affairs (MoHUA) where there is sufficient local capacity and competition and where public procurement needs to be done only from local suppliers in terms of PPP-MoU order.

"As the item HVAC is also in the list, these guidelines are also applicable for procurement of HVAC for rolling stock of Delhi-Meerut RTS project," MoHUA said in a letter to DPIIT dated May 20, 2021.

However, referring to the finance ministry order dated July 23, 2020 concerning procurement from countries sharing land border with India including procurement from China, NCRTC said it does not apply to the contracts already awarded and hence it does not apply to RTS trainset contract as it was awarded in May 2020.

A record of discussion held between DPIIT, NCRTC, and MoHUA on March 22 said, "notification of MoHUA dated May 5, 2020 was issued much after opening of the tender of Rolling stock. Hence this could not be included in the NIT of NCRTC for procurement of rolling stock."

Being a public procurement under Make in India, Bombardier India will be required to meet the minimum local content requirement under this contract, NCRTC said in response to a query from ET.

However, procurement of the sub-systems or components by Bombardier India are private procurement and therefore the decision of such procurement rests with Bombardier India meeting the overall performance requirement under this turnkey contract, it said.

NCRTC also said that the issue of HVAC procurement by Bombardier India under the subject contract has already been discussed with DPIIT and has been found in compliance with all applicable government guidelines and conditions of the contract.

G20 Goods Trade Hit Record Levels in Q1 2021: OECD

New Delhi: The Organisation for Economic Co-operation and Development (OECD) on Tuesday said international merchandise trade for the G20 reached record levels in the first quarter of 2021 with an 8% quarter-on-quarter increase in exports and an 8.1% rise in imports. India's exports rose 13.3% while imports jumped 24.7% over the trailing quarter, the highest of all G20 countries.

With the exception of the UK, all G20 economies recorded growth in the quarter; with the depreciation of the US dollar and the related increases in commodity prices playing a role in the recovery from the Covid-19 lows, OECD said.

China, the G20's largest merchandise trader, saw exports growing 18.9% and imports rising 19.0% in the first quarter of 2021. "Chinese import growth was led by metals and metal ores, cereals and integrated circuits, while export growth was led by electronic products including integrated circuits, vehicles, and textiles (including face masks)," Organisation for Economic Co-operation and Development said.

Prices of agricultural commodities, including cereals and vegetable oils, increased by over 10% in the quarter while those of metals were close to levels last observed in 2011, which benefited Argentina, Australia, Brazil and South Africa.

"Since energy products are a major import for most G20 economies, the price increases also resulted in higher import values in the same period," OECD said. —Our Bureau

Punjab FM Seeks Lower GST on Covid Vax, Medical Gear

Gulveen Aulakh
@timesgroup.com

New Delhi: Punjab finance minister Manpreet Badal has asked Union finance minister Nirmala Sitharaman to take up critical issues of lowering taxes on Covid related vaccines, ventilators, oxygen cylinders and other medical equipment in the upcoming Goods and Service Tax Council meeting on Friday.

In a letter to Sitharaman, who is the chair of the Council, Badal also asked for discussion on exemption of integrated GST on oxygen concentrators imported for personal use, on which the Delhi High Court gave a positive ruling last week.

"We need a GST with a heart and I strongly urge you to place this agenda in the ensuing meeting," he said in the letter seen by ET, highlighting the high taxes on basic essentials needed to combat the 'life-threatening' Covid-19 pandemic.

He added that many goods facing basic customs duty upto 20% and GST upto 18% besides social welfare surcharges at 10%, with IGST on imports increasing the burden by another 3%.

Badal also sought for appointing a vice-chair to the Council from amongst the states and activating the dispute resolution mechanism under the Constitution, which he said will further strengthen the federal structure of the Council.

Highlighting that all states continue to face revenue deficits — Punjab having as high as 50% — Badal asked that the floor and band of rates within which states can fix their SGST rates after June 2022 should be discussed as well.

He also sought that the Council should be empowered to vote through video conferencing.

Badal also flagged the GST Implementation Committee's conduct which has placed several of its decisions including cancellation of registration, tax compliance amendments and waiver of penalties, only for information of the Council rather than approval, as most of the decisions require amendment to rules and enactment of law.

SURYA

Empowering Lifestyles

Regd. Office : Prakash Nagar, Sankholi, Bahadurgarh, Haryana - 124507
 Corp. Office : 2nd Floor, Padma Tower I, Rajendra Place, New Delhi - 110008
 CIN No.: L31501HR1973PLC007543, Tel.: +91-11-47109000
 Website: www.surya.co.in, e-mail-id: investorgrivances@surya.co.in

Extract of Standalone and Consolidated Audited Financial Results for the Quarter and Year ended 31st March, 2021
 (Rs. in Lakhs)

STANDALONE				CONSOLIDATED			
Quarter Ended	Year Ended	Quarter Ended	Year Ended	Quarter Ended	Year Ended	Quarter Ended	Year Ended
31.03.2021	31.03.2020	31.03.2021	31.03.2020	31.03.2021	31.03.2020	31.03.2021	31.03.2020
(Audited)	(Audited)	(Audited)	(Audited)	(Audited)	(Audited)	(Audited)	(Audited)
1,72,160	1,33,841	5,55,437	5,46,902	1,72,188	1,33,865	5,56,139	5,47,105
7,729	3,902	20,914	13,937	7,762	3,942	21,147	13,995
7,729	3,902	20,914	13,937	7,762	3,942	21,147	13,995
5,830	2,955	15,650	10,221	5,854	2,980	15,831	10,255
6,023	2,965	15,775	10,014	6,046	2,990	15,956	10,048
5,361	5,441	5,361	5,441	5,361	5,441	5,361	5,441
10.87	5.43	29.01	18.78	10.92	5.48	29.35	18.85
10.71	5.43	28.76	18.78	10.76	5.48	29.10	18.85

29% TURNOVER
60% Cash Profit
96% PAT
Q4 FY (2021 vis 2020)

For Surya Roshni Limited Sd/ **Raju Bista** Managing Director DIN: 01299297

Place: New Delhi
 Dated: 25th May, 2021

LINCOLN PHARMACEUTICALS LIMITED

Regd. Office: "LINCOLN HOUSE" Behind Satyam Complex, Science City Road, Sola, Ahmedabad-380060.
 CIN: L24230G1995PLC024288, Ph. No.: +91-79-4107-8000,
 Website: www.lincolnpharma.com, E-Mail: info@lincolnpharma.com.

Extract of Consolidated Audited Financial Results for the Quarter and Year Ended on 31-March-2021
 (₹ in Lakhs Except Per Share Data)

Sr. No.	Particulars	Quarter Ended		Year Ended	
		31/03/2021 (Audited)	31/12/2020 (Un-Audited)	31/03/2021 (Audited)	31/03/2020 (Audited)
1	Total Income	8,211.53	11,547.63	8,265.42	42,984.93
2	Net Profit for the Period (before and after Tax, Exceptional and Extraordinary Items)	1,531.28	1,844.35	1,153.43	8,372.09
3	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	1,258.34	1,348.32	894.03	6,225.02
4	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	1,294.90	1,336.78	845.37	6,226.93
5	Paid-up Equity Share Capital of Face Value Rs.10/- Each	2,000.00	2,000.00	2,000.00	2,000.00
6	Other Equity (Excluding revaluation reserve) as shown in the Audited Balance Sheet of Previous Year			35,529.21	29,308.88
7	Earnings Per Equity Share (Not Annualised): Basic	6.29	6.74	4.47	31.11
	Earnings Per Equity Share (Not Annualised): Diluted	6.29	6.74	4.47	31.11

Notes:

- The above standalone financial results of the Company for the Quarter and year ended March 31, 2021 have been reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors of the Company in their meeting held on Tuesday, May 25, 2021 and audited by statutory auditors of the Company. The Statutory Auditors have expressed an Un-Modified Audit Opinion.
- The Board of Directors has recommended Dividend of Rs. 1.50/- (One Rupee and Fifty Paise only) (i.e. 15% Per Share) per equity share of face value of Rs. 10.00/- for the year ended March 31, 2021, subject to approval of the members at the ensuing Annual General Meeting (AGM) of the Company.
- This statement has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS), prescribed under section 133 of the Companies Act, 2013, and other recognized accounting practices and policies to the extent applicable.
- Standalone Details:

Sr. No.	Particulars	Quarter Ended		Year Ended	
		31/03/2021 (Audited)	31/12/2020 (Un-Audited)	31/03/2021 (Audited)	31/03/2020 (Audited)
A	Revenue From Operations	7,754.05	11,219.23	7,526.20	41,305.50
B	Profit Before Tax	1,478.96	1,815.68	1,138.22	8,101.24
C	Profit After Tax	1,184.94	1,336.83	923.32	6,040.61

The above is an Extract of the detailed format of Quarter Ended Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015. The Full Format of the Quarter ended Financial Results are available on the Stock Exchanges website i.e. www.bseindia.com & www.nseindia.com and on the website of the Company i.e. www.lincolnpharma.com.

For Lincoln Pharmaceuticals Limited Sd/- **Mahendra G. Patel** Managing Director DIN: 00104706

PLACE: AHMEDABAD
 DATE: MAY 25, 2021

STOVE KRAFT LIMITED

Corporate Office: #81, Harohalli Industrial Area, Kanakapura Taluk, Ramnagara District - 562112.
 Ph. : 080 28016222 | Email: cs@stovekraft.com | Website: www.stovekraft.com
 CIN No. : U28301KA1999PLC025857

Revenue ₹859 Cr. +28%
EBITDA ₹113 Cr. +235%
PAT ₹81.4 Cr. +2469%
EPS ₹26.7 +2443%

(₹ in Million, except per share data)

Sr. No.	Particulars	Quarter Ended		Year Ended	
		31st Mar 2021	31st Mar 2020	31st Mar 2021	31st Mar 2020
		UnAudited	UnAudited	Audited	Audited
1	Revenue from Operations	2,354.41	1,539.96	8,589.57	6,698.61
2	EBITDA*	252.15	(13.81)	1,130.38	337.93
3	Profit Before Tax	192.09	(102.50)	814.56	35.35
4	Profit After Tax for the period	192.09	(102.50)	814.56	31.71
5	Total Comprehensive Income for the period	202.10	(103.81)	837.85	29.15
6	Paid up Equity Share Capital (Face Value of ₹10/- each)	325.90	247.17	325.90	247.17
7	Earnings per Share** Basic (in Rs.) (Face value of ₹10/- each)	6.06	(3.40)	26.70	1.05
8	Earnings per Share** Diluted (in Rs.) (Face value of ₹10/- each)	5.98	(3.40)	26.33	1.05

Notes:

- Revenue Other Income: **EPS is not annualized for the quarter ended March 31, 2021 and quarter ended March 31, 2020.
- 1. Key standalone financial information** (Rs. in Million)

Sr. No.	Particulars	Quarter Ended		Year Ended	
		31st Mar 2021	31st Mar 2020	31st Mar 2021	31st Mar 2020
		UnAudited	UnAudited	Audited	Audited
1	Revenue from Operations	2,354.41	1,539.96	8,589.57	6,698.61
2	EBITDA*	252.15	(16.98)	1,127.95	337.59
3	Profit Before Tax	192.09	(104.09)	811.84	28.41
4	Profit After Tax for the period	192.09	(104.09)	811.84	28.41

- 2. Key Consolidated Balance Sheet Information** (Rs. in Million)

Sr. No.	Particulars	As On	
		31st Mar 2021	31st Mar 2020
		Audited	Audited
1	Total Equity	3,014.48	(599.54)
2	Net Debt	150.59	3,185.19

- The above Consolidated financial results for the quarter and year ended March 31, 2021 were reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors at their meeting held on May 25, 2021.
- The Financial Statements have been prepared in accordance with Indian Accounting Standards ("IndAS") prescribed by section 133 of the Companies Act 2013 and in terms of Regulation 33 of SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015.
- The figures for the quarter ended March 31, 2021 are the balancing figures between the audited figures in respect of the full financial year upto March 31, 2021 and the un-audited published year-to-date figures upto December 31, 2020, being the date of the end of third quarter of the financial year, which were subject to limited review by the statutory auditors.
- The Statement includes results for the quarter ended March 31, 2020 presented based on information compiled by the management in accordance with Ind AS, which have not been subjected to a separate audit or review by the statutory auditors. However, the management has exercised necessary due diligence to ensure that the financial results for the quarter ended March 31, 2020 provide a true and fair view of the group's affairs.
- The above is an extract of the detailed format of audited financial results filed with the stock exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015. The full format of the audited financial results are available on the Stock Exchange websites www.nseindia.com and www.bseindia.com and on the company's website www.stovekraft.com

Date : May 25th, 2021
 Place: Bengaluru

For & On Behalf of the Board
Rajendra Gandhi
 Managing Director

BLENDO
THE ANY MOMENT BLENDER

SAFETY LID AUTO OFF 120 SEC DOUBLE PRESS TO START EASY-TO-CARRY BAND

STROBE JAY MOTOR 2 POWERFUL BLADES ANT-SLIP SLEEVE 330 W PORTABLE BLENDER

PERFECT FOR ANYONE, ANYTIME, ANYWHERE

નાની સરકારી બેંકોને એકબીજામાં વિલીન કરવાની નીતિ સહકારી બેંકોમાં લાગુ થશે

હવે સહકારી બેંકોના મર્જર માટે ચક્રો ગતિમાન

નવી દિલ્હી તા.૨૫ કેન્દ્ર સરકારે બહાર ક્ષેત્રની સરકારી બેંકોને મર્જ કરીને મોટી બેંકો રચવાની દિશામાં નીતિ અપનાવી જ છે અને હવે તેમાં આગળ વધીને સહકારી બેંકોનાં વિલીનીકરણની દિશામાં મહત્વપૂર્ણ સંકેત આપ્યો છે. જહા કેન્દ્રીય સહકારી બેંકોને રાજ્ય સહકારી બેંકોમાં મર્જ કરવાની વિચારણા કરવાનું રિઝર્વ બેન્કે બહાર કહ્યું છે. રાજ્ય સરકારે તરફથી થયેલી દરખાસ્તને પગલે રીઝર્વ બેન્કે આ દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે. રાજ્ય તથા જહા સહકારી બેંકોને રીઝર્વ બેન્ક હેઠળ લાવવા માટે કેન્દ્ર સરકારે નવો કાયદો ઘડ્યો જ હતો. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ ૨૦૨૦ સહકારી બેંકો માટે ૧ એપ્રિલ ૨૦૨૧ થી અમલી બન્યો છે. હવે સહકારી બેંકોના મર્જ માટે રીઝર્વ બેન્કની પૂર્વ પરવાનગી જરૂરી બની

જાય છે. સુત્રોએ જણાવ્યું છે કે અમુક રાજ્ય સરકારોએ જહા સહકારી બેંકોને રાજ્ય સહકારી બેંકો સાથે કેડીટ સ્ટ્રક્ચર સ્વરૂપે મર્જ કરવા માટે

ઉપરાંત વધારાની મૂડી ઢાલવા માટે પણ રણનીતિ તૈયાર કરવી પડશે. જરૂર પડ્યે નાણાકીય મદદ આપવાની તૈયારી, નફાકારક મોડલ તથા મર્જ બેંકોનું વહિવટી મોડલ પણ તૈયાર કરવું પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા વર્ષોમાં અનેક રાજ્યોમાં સહકારી બેંકોમાં અનિયમીતતા, ગરબડ તથા નાણાકીય કોષાંડો બહાર આવ્યા છે રિઝર્વ બેન્કે વખતો વખત દંડ સહીતનાં પગલા પણ લીધા છે. અમુક

જહા સહકારી બેંકોને રાજ્ય સહકારી બેંકમાં મર્જ કરવાની રાજ્ય સરકારોની દરખાસ્ત પર રિઝર્વ બેન્કે ગાઈડલાઈન જાહેર કરી દીધી: આવશ્યક મૂડીથી માંડીને વહિવટી મોડલ તથા નાખાઈની ભૂમિકા સામેલ

રીઝર્વ બેન્કનો સંપર્ક કર્યો હતો તેના આધારે રીઝર્વ બેંક દ્વારા દિશા નિર્દેશો જારી કરી દેવામાં આવ્યા છે. રિઝર્વ બેન્કની આ ગાઈડ લાઈનસ મુજબ રાજ્ય સરકારો કાનૂની માળખાઓને વિસ્તૃત અભ્યાસ રીપોર્ટ સાંપે ત્યારબાદ જહા સહકારી બેંકોના રાજ્ય સહકારી બેંક સાથે મર્જ વિશે રીઝર્વ બેન્ક વિચારશે. આ

રિઝર્વ બેન્કની માર્ગદર્શિકા પ્રમાણે સંબંધીત શેરધારકોની મંજૂરી અનિવાર્ય રહેશે તેમજ રાજ્ય સરકારની દરખાસ્ત નકારીને નાબોર્ડ પણ મંજૂરી આપવી પડશે. નાખાઈનાં પ્રસ્તાવના આધારે રીઝર્વ બેંક સહકારી બેંકોનાં મર્જની યોગ્યતા ચકાસશે અને ત્યારબાદ બે તબક્કે મંજૂરી પ્રક્રિયામાં આગળ ધપશે.

રહે તેને પ્રાધાન્ય આપવામાં આવે છે. રિઝર્વ બેન્કના એક સીનીયર અધિકારીએ કહ્યું કે ગુજરાત, મહારાષ્ટ્ર, સહિતના રાજ્યોમાં સહકારી બેંકોનાં ઉદ્ભવના અને નાના ગ્રાહકોનાં કારોડ રૂપિયા ડુબી ગયાના દાખલા મોજુદ છે. એટલે રીઝર્વ બેન્કના પગલા અનિવાર્ય થઈ પડે છે.



સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તથા બ્રાંચમાંથી રોકડ ઉપાડ અને ચેકબુક ચાર્જ વધાર્યા

નવી દિલ્હી તા.૨૫ દેશની સૌથી મોટી રાષ્ટ્રીય કૃત બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તા. ૧ જુલાઈથી અમલમાં આવે તે રીતે તેના એટીએમમાંથી રોકડ ઉપાડ, ચેકબુક તથા અન્ય ચાર્જમાં વધારો કરવા નિર્ણય લીધો છે. બેંક દ્વારા બહાર કરાયેલી માહિતી મુજબ હાલ જે એટીએમમાંથી ચાર વ્યવહારો ફી છે તે બાદના દરેક વ્યવહારો પર તથા બેંકની શાખામાં રોકડ ઉપાડ પર રૂ.૧૫ તથા જીએસટીનો ચાર્જ લાગશે. તે બેંકની વેબસાઇટ મુજબ બ્રાંચ અને એટીએમ બંનેમાં ગ્રાહક વધુમાં વધુ ચાર વખત રોકડ ઉપાડ એક માસમાં કરી શકે છે અને હવે સ્ટેટ બેંકના એટીએમ કે અન્ય બેંકના એટીએમ તથા બેંકની શાખામાંથી આ ચાર ઉપાડ લિવાયના દરેક ઉપાડ પર વધારાનો ચાર્જ લાગશે. સ્ટેટ બેંક આ ઉપરાંત ૧૦ પાનાની ચેકબુકમાં રૂ.૪૦ તથા જીએસટી ચાર્જ વસુલવા નિર્ણય લીધો છે.

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા છ મહિનાથી આંદોલન કરી રહેલા ખેડૂતોના આંદોલનને ૨૬ મે ના રોજ છ માસ પુરા થતા હોવાથી ૨૬ મે કાળો દિવસ (બ્લેક ડે) તરીકે મનાવવાની કરેલા એલાનને લઈને બ્લેક ડે ના આગલા દિવસે દિલ્હીની ટિકરી બોર્ડર ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રા બતાવવા એકત્ર થઈ દેખાવો કરી રહ્યા છે.

કરવેરામાં રાહત સાથે રૂ.૧ લાખ કરોડના પેકેજની તૈયારી

નવી દિલ્હી: કરોડોની બીજી વહેરમાં દેશમાં ફરી એક વખત વ્યાપાર ઉદ્યોગને પહેલા ફટકા તથા આમ આદમીને જે આર્થિક સહીતના પ્રવાસન, વિમાની ઉડ્ડયન, હોટેલ ઉદ્યોગોને ખાસ રાહત આપો: નાના-મધ્યમ કદના ઉદ્યોગોને પણ બેન્ક ગેરન્ટી સહિતની યોજના: નાણા મંત્રાલય દ્વારા ચૂપકીદીથી કામકાજ શરૂ

અને જે વ્યાપક લોકડાઉનની સ્થિતિ છે તેનાથી હવે દેશમાં જીવી વલ્ક્યાંક પણ ઘટાડવામાં આવી રહ્યો છે. મોટી સરકાર પાસે નવું રાહત ચૂપકીદીથી કામ કરી રહ્યું છે. નામ બદલેલ છે જુનું નામ નિશારખાન યુવામહોલમદ પદાણ બદલીને નવું નામ નિશાર મોહમદ યુવામહોલમદ રાખેલ છે. સરનામું: ૩૫૪૫ બી-૩, ત્રીજે માળ ફરહત મંડીલ ગલી નં. ૩, સોદાગરની પોળ, કાલુપુર, અમદાવાદ-૩૮૦૦૦૧

રાંધણ ગેસની ડિલિવરી કરનારાને વેક્સિન આપવા માગ દેશના રાંધણ ગેસના ડિલિવરી બોય સુપર સ્પ્રેડર બની શકે છે નવી દિલ્હી, તા. ૨૫ રાંધણ ગેસ પહોંચાડનારા લોકોને શક્ય તેટલી ઝડપથી કરોના વેક્સિન આપવાની માંગણી જોર પકડી રહી છે. અતિ આવશ્યક વસ્તુઓમાં સામેલ રાંધણ ગેસને એ સમયે પણ પૂરો પાડવામાં આવ્યો હતો જ્યારે કરોના સંક્રમણ તેના ચરમ સ્તરે હતું. ફેરિશન ઓફ એલપીજી ડિસ્ટ્રિબ્યુટર ઓફ ઈન્ડિયાના કહેવા પ્રમાણે ગેસની ડિલિવરી આપનારા સુપરસ્પ્રેડર બની શકે છે માટે તેમને શક્ય તેટલી ઝડપથી રસી આપાય તે આવશ્યક છે. તેમને ફેન્ટલાઈન કર્યા માનીને આ માંગણી ઝડપથી પૂરી કરવા કહેવામાં આવ્યું છે કારણ કે, કોવિડ કાળમાં પણ તેઓ બીમારીને ભૂલીને કરોના યોદ્ધાઓની માફક લોકોની સેવા કરી રહ્યા હતા. તેમના કારણે જ લોકડાઉન દરમિયાન લોકો ઘરેબેઠા રસોડામાં રાંધી શક્યા હતા. એલપીજી ડિલિવરી બોય દેશભરના ૬૫-૭૫ લાખ ઘરોમાં

પેકેજ આપવા પુરતી નાણાકીય જોગવાઈ છે. હાલમાં જ રીઝર્વ બેન્ક પાસે રૂ.૧ લાખ કરોડ જેનું ડીવીડન્ડ આપ્યું છે અને સરકાર આ પેકેજમાં કરરાહત આપશે જેથી સીધો લાભ મળશે. સરકાર ધિરાણ સામે ગેરન્ટી વધારશે. કરવેરામાં રાહત આપશે જેથી માંગ વધે. જો કે નાણા મંત્રાલય તેના પર ખૂબ જ

નામ બદલેલ છે જુનું નામ સહેલા શાહીદ એહમદ પટેલ નવું નામ સાહેલા શાહીદ એહમદ પટેલ રાખેલ છે. સરનામું: ૬૩૧, મોટી મોમના વાડ ગાયકવાડ હવેલી પાસે, રાયખડ, અમદાવાદ-૩૮૦૦૦૧

નામ બદલેલ છે મારી માયનોર પુત્રીનું નામ પટેલ હાવ્ય હતું તે બદલીને પટેલ હાવ્ય અજેશભાઈ રાખેલ છે. સરનામું: વૃંદાવનઈલા વિભાગ-૫, ડ્રાઈવીન હાઈલેન્ડની સામે, સોલા, અમદાવાદ-૩૮૦૦૬૦

નામ બદલેલ છે મારૂ જુનું નામ સીધપુરવાળા મુબશરા ઈરફાનભાઈ હતું તે બદલીને નવું નામ કુકડાવાલા મુબશરીરા રાખેલ છે. ૩૮૪/૨૮૯૧ ખાંડની શેરી, જમાલપુર, અમદાવાદ

નામ બદલેલ છે મારૂ જુનું નામ પટેલ મીતેષકુમાર બિહારીભાઈ હતું તે બદલીને નવું નામ પટેલ મીતેષભાઈ બિહારીભાઈ રાખેલ છે. દેસાઈનગર, તલોદ, સા.કા.

નોકરી ગુમાવવા અથવા પગારકાપને કારણે લોકો હતા નથી ચુકવી શકતા

કોરોનાથી આર્થિક પાયમાલી: હોમલોન ડીફોલ્ટર્સ વધ્યા

નોકરી ગુમાવવા અથવા પગારકાપને કારણે લોકો હતા નથી ચુકવી શકતા કોરોનાની પ્રવર્તમાન ગંભીર વહેરથી દેશના લાખો લોકોની આર્થિક હાલત ડામાડોળ થઈ છે અને તેની અસર હોમલોન પર દેખાવા લાગી છે. હોમલોનમાં મારીક હમા ન હતા. ભરનારા લોનધારકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ૩૫ લાખ કે તેથી વધુની લોન લેનારા વર્ગમાં ડીફોલ્ટરનું પ્રમાણ વધુ છે. કોરોનાથી લોકોને ઘરના મકાનનું મહત્વ સમજાવ્યું છે. લોકો ગમે તેમ કરીને એફોડેબલ હાઉસિંગ સ્કીમમાં ઘર ખરીદી શકાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. અને તેને કારણે ૩૫ લાખ સુધીની હોમલોનની માંગ સૌથી વધુ છે. કુલ હોમલોન પોર્ટફોલીયોમાં ૯૦ ટકા ૩૫ લાખ સુધીની લોનનો હિસ્સો છે. ૧૫ લાખ સુધીની લોનની ડીમાંડ ૭૦ ટકા છે.

વહેલો ડીફોલ્ટ થાય છે. ૨૭ થી ૪૫ વર્ષની વયગ્રુથમાં ડીફોલ્ટની સંખ્યા ઓછી છે. આ વર્ગના લોન ધારકો દ્વારા ત્રણ મહિના લોન હમા નહિ ચુકવાયાની ટકાવારી ૨.૪૮ ટકા છે. હોમલોન



નોકરી ગુમાવવા અથવા પગારકાપને કારણે લોકો હતા નથી ચુકવી શકતા તેમાં પણ ૩૦ ટકા હોમલોન ટોચની પાંચ સરકારી બેંકોએ આપી છે. જ્યારે પાંચ ખાનગી બેંકોનું હોમલોનમાં યોગદાન ૧૫ ટકા છે. નોન બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓનો હિસ્સો ૨૭ ટકા છે. રીપોર્ટમાં એવો નિર્દેશ છે કે ૩૫ લાખ સુધીની લોનની માંગ નાના શહેરોમાં વધી છે. મહાનગરો ક્રમાં ટાઇપ-ટુ-ટ્રી શહેરોમાં સરેરાશ હોમલોનની ડીમાંડમાં પણ વધારો છે.

LINCOLN PHARMACEUTICALS LIMITED Regd. Office: "LINCOLN HOUSE" Behind Satyam Complex, Science City Road, Sola, Ahmedabad-380060. QIN: L24230GJ1995PLC024288, Ph. No.: +91-79-4107-8000, Website: www.lincolnpharma.com, E-Mail: info@lincolnpharma.com. Extract of Consolidated Audited Financial Results for the Quarter and Year Ended on 31-March-2021 (₹ in Lakhs Except Per Share Data)

Sr. No.	Particulars	Quarter Ended			Year Ended	
		31/03/2021 (Audited)	31/12/2020 (Un-Audited)	31/03/2020 (Audited)	31/03/2021 (Audited)	31/03/2020 (Audited)
1	Total Income	8,211.53	11,547.63	8,265.42	42,984.93	39,753.07
2	Net Profit for the Period (before and after Tax, Exceptional and Extraordinary Items)	1,531.28	1,844.35	1,153.43	8,372.09	6,723.24
3	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	1,258.34	1,348.32	894.03	6,225.02	5,146.62
4	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	1,294.90	1,336.78	845.37	6,226.93	5,100.44
5	Paid-up Equity Share Capital of Face Value Rs.10/- Each	2,000.00	2,000.00	2,000.00	2,000.00	2,000.00
6	Other Equity (Excluding revaluation reserve) as shown in the Audited Balance Sheet of Previous Year				35,529.21	29,308.88
7	Earnings Per Equity Share (Not Annualised): Basic	6.29	6.74	4.47	31.11	25.72
	Earnings Per Equity Share (Not Annualised): Diluted	6.29	6.74	4.47	31.11	25.72

Notes: 1 The above standalone financial results of the Company for the Quarter and year ended March 31, 2021 have been reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors of the Company in their meeting held on Tuesday, May 25, 2021 and audited by statutory auditors of the Company. The Statutory Auditors have expressed an Un-Modified Audit Opinion. 2 The Board of Directors has recommended Dividend of Rs. 1.50/- (One Rupee and Fifty Paise only) (i.e. 15% Per Share) per equity share of face value of Rs. 10.00/- for the year ended March 31, 2021, subject to approval of the members at the ensuing Annual General Meeting (AGM) of the Company. 3 This statement has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS), prescribed under section 133 of the Companies Act, 2013, and other recognized accounting practices and policies to the extent applicable. 4 Standalone Details:

Sr. No.	Particulars	Quarter Ended			Year Ended	
		31/03/2021 (Audited)	31/12/2020 (Un-Audited)	31/03/2020 (Audited)	31/03/2021 (Audited)	31/03/2020 (Audited)
A	Revenue From Operations	7,754.05	11,219.23	7,526.20	41,305.50	37,608.83
B	Profit Before Tax	1,478.96	1,815.68	1,138.22	8,101.24	6,404.66
C	Profit After Tax	1,184.94	1,336.83	923.32	6,040.61	4,956.35

For Lincoln Pharmaceuticals Limited
Sd/-
Mahendra G. Patel
Managing Director
DIN: 00104706

PLACE: AHMEDABAD
DATE: MAY 25, 2021

